


ચાર્ચિતર વિદ્યામંડળ સંચાલિત
વિહુલભાઈ પટેલ એન્ડ રાજરત્ન પી.ટી. પટેલ સાયન્સ કોલેજ
વલ્લભ વિદ્યાનગર



લેબોરેટરી આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા

TIME : 120 Min.

DATE : 29/09/2024, SUNDAY

TOTAL MARKS : 150

SEAT NO.

SUBJECT : CHEMISTRY/INDUSTRIAL CHEMISTRY

ઉમેદવારોને સુચના

- પરીક્ષા Multiple Choice Question (MCQ) પદ્ધતિની રહેશે.
- દરેક પ્રશ્નનો 01 (એક) ગુણ રહેશે.
- ઓટા જવાબ દીઠ, છેકાંડકવાળા જવાબદીઠ કે એક કરતા વધુ વિકલ્પ પસંદ કરેલા જવાબદીઠ મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે, નેગેટીવ માર્કિંગ લાગુ પડશે.
- પ્રશ્નના આપેલ બધા વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહીં.
- સાચા વિકલ્પ ઉપર “O” વર્તુળ કરવું.

ઉદાહરણ તરીકે :

ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે ?

A. સરદાર પટેલ B. મહાત્મા ગાંધી C. સુભાષચંદ્ર બોઝ D. વિનોભા ભાવે

- આપ ગેરરીતી કે ગેરશિસ્ટ આચરતા હશો કે આપની પાસેથી બિન અધિકૃત પુસ્તકો, કાગળ, સાહિત્ય તથા મોબાઇલ, સ્માર્ટ વોય, કેલક્યુલેટર, પેનફ્રાઇલ વગેરે જેવા કોઈ પણ પ્રકારના વિજાણુંસાધનો મળી આવશે તો આપ ગેરલાયક ઠરશો, તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે.
- ચાલુ પરીક્ષા દરમ્યાન અંદરોઅંદર વાત કરવી, અવાજ કરવો કે સુપરવાઈઝરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવું તે ગેરશિસ્ટ ગણાશે.
- ઉમેદવારે વાદળી / કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે.
- ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયે જ પરીક્ષામંડ છોડવા દેવામાં આવશે.
- પરીક્ષા પૂર્ણ થયે ઉમેદવારે આ પ્રશ્નપત્ર બ્લોક સુપરવાઈઝરશ્રીને આપવાનું રહેશે.

ઉમેદવારની સહી

બ્લોક સુપરવાઈઝરની સહી

1. ભારતભરમાં સત્યાગ્રહનું પ્રચાર કરવા માટે ખેડૂતો દ્વારા ચોજાયેલું પ્રથમ સત્યાગ્રહ કૃંહતું?
 - A. કેડિયા સત્યાગ્રહ
 - B. ચંપારણ સત્યાગ્રહ
 - C. બારડોલી સત્યાગ્રહ
 - D. અહમદાબાદ મિલ સત્યાગ્રહ
2. 2021 માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કોણે શપથ લીધા હતા?
 - A. ભૂપેન્ધ્ર પટેલ
 - B. અનંદીબેન પટેલ
 - C. વિજય રૂપાણી
 - D. અમિત શાહ
3. ગુજરાતમાં ભાજપે પહેલીવાર કઈ સાલમાં સરકાર બનાવેલી હતી?
 - A. 1990
 - B. 2001
 - C. 1995
 - D. 1985
4. ગુજરાત અને મહારાષ્ટ્રની વિભાજન પહેલાં, આ રાજ્યનું નામ શું હતું?
 - A. મદ્રાસ સ્ટેટ
 - B. સૌરાષ્ટ્ર સ્ટેટ
 - C. બોપ્રે સ્ટેટ
 - D. કાઠીયાવાડ સ્ટેટ
5. 1960માં ગુજરાતના મુખ્ય પ્રધાન કોણા બન્યા હતા?
 - A. બલવંતરાય મહેતા
 - B. ઉર્ધુંગરાય ઢીલા
 - C. જિવરાજ મહેતા
 - D. ઇન્દ્રલાલ યાહીક
6. જરાતનું સૌથી ઊંચું શિખર કૃંહતું છે?
 - A. સાપુતારા
 - B. ગિરનાર
 - C. પાવાગઢ
 - D. ઝરવાણી
7. નલ સરોવર ક્યા પ્રકારનું ક્ષેત્ર છે?
 - A. પર્વતીય ક્ષેત્ર
 - B. જંગલ વિસ્તાર
 - C. રણ વિસ્તાર
 - D. પક્ષી અભયારણ્ય
8. કઈ નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે?
 - A. તાપી
 - B. સાબરમતી
 - C. માહી
 - D. નર્મદા
9. દ્રાવણોની સાંક્રતા (Concentration) શું છે?
 - A. દ્રાવણના આપેલા જથ્થામાં દ્રાવ્યનું પ્રમાણ
 - B. દ્રાવણના આપેલા જથ્થામાં વિલાયકનું પ્રમાણ
 - C. દ્રાવણનો કુલ જથ્થો
 - D. દ્રાવ્યનું વજન

10. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંમતુલ્ય વજન (Equivalent weight) શું છે?
- A. 40 g/mol
 - B. 20 g/mol
 - C. 60 g/mol
 - D. 80 g/mol
11. બ્રોમિન પાણીનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે?
- A. હાઇડ્રોજનેશન
 - B. હાલોજનેશન
 - C. ઓક્સિડેશન
 - D. રિડક્શન
12. કઈ "ડેઇ" (Dyes) બેક્ટેરિયાને મારવા માટે ઉપયોગ થાય છે?
- A. મેથિલિન બ્લુ
 - B. કિસ્ટલ વાયોલેટ
 - C. કોન્ફો રેડ
 - D. ઇન્ડિગા
13. Which of the following is a noun?
- A. Quickly
 - B. Beautiful
 - C. Apple
 - D. Run
14. Which of the following is a pronoun?
- A. She
 - B. Running
 - C. Quickly
 - D. Apple
15. Which word is a verb?
- A. Bright
 - B. Happiness
 - C. Slowly
 - D. Jump
16. Choose the correct preposition: "The car is parked ___ the house."
- A. Behind
 - B. Under
 - C. Over
 - D. Next to
17. "હું" કયા પ્રકારનું સર્વનામ છે?
- A. પુરુષવાચક
 - B. નિશ્ચયવાચક
 - C. પ્રમાણવાચક
 - D. વ્યક્તિવાચક
18. "સિંહ" શબ્દ કયા લિંગમાં છે?
- A. સ્ત્રીલિંગ
 - B. નપુંસક લિંગ
 - C. પુરુંગ
 - D. ત્રिलિંગ
19. 'ઉપકાર' શબ્દનો વિપરિત અર્થ શું છે?
- A. કૃતધનતા
 - B. સદાચાર
 - C. પુણ્ય
 - D. દાન

20. મારો કયા પ્રકારનું વિશેષણ છે?

- | | |
|---|---------------|
| A. અધિકારવાચક | C. ગુણવાચક |
| B. સંખ્યાવાચક | D. કિયાવાચક |
| 21. પદાર્થને સૂક્ષ્મ કણોમાં કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે? | |
| A. ડિલ્ટેશન | C. ડિસ્ટિલેશન |
| B. કશિંગ | D. ગેસિક મિશણ |

22. API (Active Pharmaceutical Ingredients) અંદર્જની ચોકસાઈને (Accuracy of API) ઘટાડતી પરિબળો શું છે?

- | |
|-----------------------------|
| A. રસાયણોની અંશુદ્ધિ |
| B. સાધનોની ખામી |
| C. માપન કરનાર વ્યક્તિની ભૂલ |
| D. ઉપરના બધા |

23. "હાઇડ્રોજેશન" (Hydrogenation) પ્રક્રિયા એ મુખ્યત્વે કયા માટે થાય છે?

- | |
|---------------------------------|
| A. તેલને ઠંડું રાખવા માટે |
| B. તેલમાં વધારે ફેટ ઉમેરવા માટે |
| C. તેલને ઘી જેવું બનાવવું |
| D. તેલમાંથી પાણી દૂર કરવા માટે |

24. ક્લાઉડ પોઇન્ટ (Cloud point) શું છે?

- | |
|---|
| A. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં મીણ સ્ફિટિકો દેખાવાનું શરૂ કરે છે |
| B. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન સ્થિર થાય છે |
| C. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન પ્રવાહી બને છે |
| D. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનનું વજન બદલાય છે |

25. સલ્ફ્યુરિક એસિડનું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?

- | | |
|-------------|-------------|
| A. 49 g/mol | C. 48 g/mol |
| B. 98 g/mol | D. 89 g/mol |

26. કયું ક્રિય રંગદ્રવ્યના ક્ષેત્રમાં 'મહત્વપૂર્ણ રીડક્શન એજન્ટ' (important reducing agent) તરીકે ઓળખાય છે?

- | |
|-------------------------|
| A. સોડિયમ સલ્ફાઈટ |
| B. સોડિયમ હાઇપોક્લોરાઈટ |
| C. હાઇડ્રોસલ્ફાઈટ |
| D. સોડિયમ કાર્బોનેટ |

27. "सिन्थेटिक डाई" (Synthetic Dyes) कઈ वस्त्र उद्योगमां सौथी वधु उपयोगमां लेवाय छे?

- A. कपास
- B. नायंलोन
- C. रेशम
- D. पोलिएस्टर

28. आल्किल बेन्जीन (Alkyl benzene) Preparation माटे कया पद्धतिनो उपयोग थाय छे?

- A. फ़िडेल-काफ़िट्स एल्किलेशन
- B. डीक्लोजिस्टेशन
- C. विमलन
- D. हाइड्रोलिसिस

29. पदार्थने नाना कणोमां बनाववा माटे कयो पद्धति श्रेष्ठ छे?

- A. किस्टलाइओशन
- B. मिक्सिंग
- C. मिकानिकल ग्राइन्डिंग
- D. विमलन

30. "डिस्टिलेशन" अने "फ़ेक्शनल डिस्टिलेशन" मानो मुख्य तकावत शुं छे?

- A. डिस्टिलेशन सरब भिशाणे अलगा करे छ, ज्यारे फ़ेक्शनल डिस्टिलेशन जटिल भिशाणे
- B. फ़ेक्शनल डिस्टिलेशन भिशाणे सरब बनावे छ, ज्यारे डिस्टिलेशनने जटिल बनावे छ
- C. डिस्टिलेशन मात्र सोलिड पदार्थोने अलगा करे छ, ज्यारे फ़ेक्शनल डिस्टिलेशन लिक्विड पदार्थोने
- D. डिस्टिलेशन सेटिंग जरुरी छ, ज्यारे फ़ेक्शनल डिस्टिलेशन लेबोरेटरी उपयोग माटे छे.

31. जो $KMnO_4$ मोलेक्युलर वजन 158 ग्राम/मोल होय तो, $KMnO_4$ नु समतुल्य वजन (Equivalent weight) शुं छे?

- A. 31.6 g/mol
- B. 158 g/mol
- C. 185 g/mol
- D. 36.5 g/mol

32. नीचेनामांथी, गांधीजुनुं जन्मस्थल कयुं छे?

- A. पोरबंदर
- B. नडियाद
- C. झनागढ
- D. वलसाई

33. भारतनुं बँधारणा भनावनार संविधान सभाना अध्यक्ष कोण हता?

- A. डो. बाबासाहेब आंबेडकर
- B. सरदार वल्लभभाई पटेल
- C. जवाहरलाल नहेड़
- D. डो. राजेन्द्र प्रसाई

34. દાંડી સત્યાગ્રહ ક્યારે શરૂ થયું?

A. 1931

C. 1932

B. 1930

D. 1933

35. દાંડી સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધીએ કેટલા દિવસોમાં દાંડી પહોંચ્યું?

A. 30

C. 15

B. 24

D. 10

36. HClનું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?

A. 36.5 g/mol

C. 25.3 g/mol

B. 65.3 g/mol

D. 56.3 g/mol

37. ખ્રોમિન પાણીનો ઉપયોગ કઈ સંયોજનની શોધ માટે થાય છે? (detection of which compound?)

A. આલ્કેન

B. આલ્કોન

C. એરોમેટિક સંયોજનો

D. યાદીમાંથી કોઈ નથી

38. પાતળું પાડવાનો (Dilution of solution) સૂત્ર શું છે?

A. C₁V₁ = C₂V₂

C. V₁C₂ = V₁C₂

B. C₁V₂ = C₂V₁

D. V₁V₂ = C₁C₂

39. 1 N HCl દ્રાવણમાંથી, 100 mL ના 0.1 N HCl દ્રાવણ કેવી રીતે તૈયાર કરશો?

A. 1 N HCl ના 10 mL ને 90 mL પાણી સાથે પાતળું કરો

B. 1 N HCl ના 100 mL ને 900 mL પાણી સાથે પાતળું કરો

C. 1 N HCl ના 1 mL ને 99 mL પાણી સાથે પાતળું કરો

D. 1 N HCl ના 100 mL ને 100 mL પાણી સાથે પાતળું કરો

40. API (Active Pharmaceutical Ingredients) શું છે?

A. દવાઓમાં વપરાતા સક્રિય પદાર્�ો

B. દવાઓમાં વપરાતા નિષ્ઠિય પદાર્થો

C. દવાઓના ઉત્પાદનમાં વપરાતા રસાયણો

D. દવાઓના ઉત્પાદનમાં વપરાતા સાધનો

41. ખાદ્ય તેલ નીકળવા માટે ક્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

A. ફિલ્ટરિંગ

C. એક્સિડ

B. તાપન અને દબાણ

D. ટંડક અને જમાવટ

42. કયા તેલમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉપસ્થિતિ સૌથી વધુ હોય છે?
- A. ફેલેક્સસીડ તેલ
 - B. મગાફલી તેલ
 - C. મસતર્ડ તેલ
 - D. સોયાબીન તેલ
43. ખાદ્ય તેલમાંથી ગંધ અને અશુદ્ધિઓ દૂર કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
- A. ડિલ્ટરિંગ
 - B. ડિસમેલિંગ
 - C. ન્યુટ્રલાઇઝેનન
 - D. ડિકન્ટિંગ
44. ગુજરાતીમાં વર્તમાન કિયાપદનો સાચો ઉદાહરણ કયો છે?
- A. મેં ખાવું.
 - B. હું ખાઉં છું.
 - C. હું ખાતો હતો.
 - D. હું ખાઈશ.
45. ગુજરાતીમાં કિયાપદના નિર્જિય સ્વરૂપનો સાચો ઉદાહરણ કયો છે?
- A. પુસ્તક વાંચવામાં આવ્યું.
 - B. તેણે પુસ્તક વાંચ્યું.
 - C. તે પુસ્તક વાચે છે.
 - D. પુસ્તક વાંચ્યું હતું.
46. "સહનશક્તિ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
- A. શાંતિ
 - B. ગુર્સો
 - C. અસહનશક્તિ
 - D. નરમ
47. "ઉતાવળ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
- A. જલ્દી
 - B. મોડુ
 - C. ધીરજ
 - D. શાંતિ
48. મોલારિટી (M) નો એકમ શું છે?
- A. દ્રાવણના એક લિટર દીઠ દ્રાવ્યના મોલ
 - B. દ્રાવણના એક લિટર દીઠ દ્રાવ્યના ગ્રામ
 - C. વિલાયકના એક ગ્રામ દીઠ દ્રાવ્યના ગ્રામ
 - D. વિલાયકના એક ગ્રામ દીઠ દ્રાવ્યના મોલ
49. સોલ્વેન્ટ એક્સટ્રેક્શન (Solvent extraction) પદ્ધતિમાં કયા પદાર્થનો ઉપયોગ તેલ કાઢવા માટે થાય છે?
- A. પાણી
 - B. ઇથેનોલ
 - C. હેક્સેન
 - D. એસિટોન

50. એક પરીક્ષણમાં "ASTM" શું છે?

- A. અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટિરિયલ્સ
- B. એશિયન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ મટિરિયલ્સ
- C. આફ્રિકન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ મટિરિયલ્સ
- D. ઓર્સ્ટ્રેલિયન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ મટિરિયલ્સ

51. પોલિમરની સ્નિગ્ધતા (Viscosity of the Polymer) માપવા માટે કઈ પક્ષતિઓનો

ઉપયોગ થાય છે?

- A. કેપિલરી વિસ્કોસિમીટર (Capillary Viscometer)
- B. રોટાશનલ વિસ્કોસિમીટર (Rotational Viscometer)
- C. બબ્લ વિસ્કોસિમીટર (Bubble Viscometer)
- D. ઉપરના બધા

52. કઈ આપત્તિ સૌથી વધુ જાનહાનિ કરે છે?

- A. પૂર
- B. ચકવાત
- C. ભૂકંપ
- D. આગ

53. આપત્તિ વ્યવસ્થાપન માટે કઈ સંસ્થા જવાબદાર છે?

- A. રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)
- B. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA)
- C. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલય
- D. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા

54. પર્યાવરણના ઘટકો કયા છે?

- A. ભૌતિક અને રાસાયણિક
- B. રાસાયણિક અને જૈવિક
- C. ભૌતિક અને જૈવિક
- D. ભૌતિક, રાસાયણિક અને જૈવિક

55. પર્યાવરણના પ્રદૂષણના કારણો શું છે?

- A. ઉદ્યોગો અને વાહનો
- B. વાહનો અને જેતી
- C. ઉદ્યોગો અને જેતી
- D. ઉદ્યોગો, વાહનો, જેતી

56. રેડવુડ વિસ્કોસિમીટર (Redwood Viscometer) શું છે?

- A. પ્રવાહીની સાંક્રતા માપવા માટે વપરાતું સાધન
- B. પ્રવાહીની સ્નિગ્ધતા માપવા માટે વપરાતું સાધન
- C. પ્રવાહીનું વજન માપવા માટે વપરાતું સાધન
- D. પ્રવાહીનું વોલ્યુમ માપવા માટે વપરાતું સાધન

57. પોર પોઇન્ટ (Pour Point) શું છે?

- A. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન સ્થિર શર્દને પ્રવાહી બનવાનું બંધ કરે છે
- B. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન પ્રવાહી બને છે
- C. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનનું વજન બદલાય છે
- D. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં મીણ કિસ્ટલો દેખાવાનું શરૂ કરે છે

58. 'સ્પેક્ટ્રોસ્કોપી' એ કઈ પદ્ધતિ સાથે સંબંધિત છે?

- A. મિશ્રણના તત્વોનો વિશ્લેષણ
- B. પદાર્થની ધૂવક મર્યાદા માપવી
- C. પદાર્થની પ્રકાશ અવશોષણ અથવા નિરિષ્ણા દ્વારા વિશ્લેષણ
- D. પદાર્થના સૃષ્ટિ લક્ષ્યાને અભ્યાસ કરવો

59. "કોમેટોગ્રાફી" શું થાય છે?

- A. પદાર્થના તાણ માપવા માટે
- B. પદાર્થના ભાગોને અલગ કરવા માટે
- C. પદાર્થની તાપમાન સુસંગતતા માટે
- D. પદાર્થની દ્રાવ્યતા માટે

60. Choose the correct passive voice form: "Someone is cleaning the office."

- A. The office was cleaned by someone.
- B. The office is cleaned by someone.
- C. The office will be cleaned by someone.
- D. The office is being cleaned by someone.

61. Choose the correct option: "I need _____ time to finish my homework."

- | | |
|-------------|-----------|
| A. Few | C. Little |
| B. A little | D. A few |

62. "કવાન્ડેરેટિવ એનાલિસિસ" (Quantitative analysis) એ કઈ પ્રકારની વિશ્લેષણને સંકેત આપે છે?

- A. પદાર્થના ગુણવત્તા
- B. પદાર્થના દ્રાવ્યતા
- C. પદાર્થની માત્રા
- D. પદાર્થના સંગ્રહની રીત

63. કયા પક્ષતિમાં પદાર્થના કણોની ગંતિશીલતા નો આધાર લેવાય છે?

- A. સ્પેક્ટ્રોસ્કોપી
- B. ક્રોમેટોગ્રાફી
- C. ઇલેક્ટ્રોફોરિસિસ
- D. પિપેટિંગ

64. જો 500 મીલીલિટર (mL) 0.1 N NaCl સોલ્યુશન તૈયાર કરવું હોય, તો તમારે NaCl ના કેટલાય ગ્રામ જરૂરી છે? (NaCl નું MW 58.44 g/mol છે)

- A. 2.922 g
- B. 5.844 g
- C. 1.464 g
- D. 3.000 g

65. "ડિસ્ટિલેશન" (Distillation) પક્ષતિનો ઉપયોગ કયા પ્રકારની પદાર્થોને અલગ કરવા માટે થાય છે?

- A. સોલિડ-સોલિડ મિશ્રણ
- B. લિક્વિડ-લિક્વિડ મિશ્રણ
- C. ગેસ-ગેસ મિશ્રણ
- D. કોઈ વિકલ્પ નથી

66. કિકેટમાં કયા દેશને "કિકેટના જન્મસ્થળ" તરીકે ઓળખવામાં આવે છે?

- A. ભારત
- B. ઓસ્ટ્રેલિયા
- C. પાકિસ્તાન
- D. ઇંગ્લેન્ડ

67. વર્બલ તર્કની કસોટીમાં શું પરીક્ષણ થાય છે?

- A. ચિત્રો અને આકૃતિઓનો ઉપયોગ કરવાની ક્ષમતા
- B. તાકિક રીતે વિચારવાની ક્ષમતા
- C. શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરવાની ક્ષમતા
- D. સમસ્યા હલ કરવાની ક્ષમતા

68. તાકિક રીતે વિચારવા માટે કઈ કૌશલ્યો જરૂરી છે?

- A. વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન
- B. વિશ્લેષણ અને સંશ્લેષણ
- C. સંશ્લેષણ અને મૂલ્યાંકન
- D. વિશ્લેષણ અને મૂલ્યાંકન

69. જાહેર વહીવટમાં સુશાસનનો અર્થ શું છે?

- A. સરકારી સંસ્થાઓનું કાર્યક્ષમ અને પારદર્શી સંચાલન
- B. સરકારી નિતિઓનું ઝડપી અમલીકરણ
- C. સરકારી સેવાઓનો ઝડપી અને સરળ પ્રાપ્તિ
- D. ઉપરોક્ત તમામ

70. "સેન્સિટિવ રેઅક્ટિવ" (Sensitive Reactive) પદ્ધતિ કઈ separation technique ને સંકેત કરે છે?

- A. સ્પેક્ટ્રોસ્કોપી
- B. ક્રોમેટોગ્રાફી
- C. એલેક્ટ્રોફોરિસિસ
- D. ઉપરોક્ત તમામ વિકલ્પો

71. "બાધ્યીભવન" પદ્ધતિ શું છે

- A. એકમ પ્રક્રિયા (Unit Process)
- B. એકમ કામગીરી (Unit Operation)
- C. એકમ પ્રક્રિયા અને કામગીરી બંને
- D. ઉપરોક્ત તમામ વિકલ્પો

72. "સેન્ટ્રિફ્યુશન" પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે?

- A. સોલિડ-સોલિડ મિશ્રણને અલગ કરવા માટે
- B. લિક્વિડ-લિક્વિડ મિશ્રણને અલગ કરવા માટે
- C. અલગ પદાર્થોને ગતિશીલતાથી અલગ કરવા માટે
- D. પદાર્થોના કિસ્ટલાઇઝેશન માટે

73. "સોલ્વેન્ટ એક્સટ્રેક્ટન" પદ્ધતિનો ઉપયોગ ક્યા પ્રકારના પદાર્થોની નિર્વાહ માટે થાય છે?

- A. પદાર્થોની કિસ્ટલાઇઝેશન
- B. તેલ અને સુગંધિત પદાર્થોની નિર્વાહ
- C. પદાર્થોના ભૌતિક સ્વરૂપને બદલો
- D. મિશ્રણના તાપમાન માપવું

74. "સ્ટેમ ડિસ્ટિલેશન" પદ્ધતિનો ઉપયોગ કોણે નિર્વાહ માટે થાય છે?

- A. દ્રાવકમાંથી મિશ્રણને અલગ કરવું
- B. જૈવિક કણોને અલગ કરવા માટે
- C. તેલ અને સુગંધિત પદાર્થો કાઢવા માટે
- D. પાણી અને ગેસને અલગ કરવું

75. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનું દિસંગી મિશ્રણ કેવી રીતે અલગ કરી શકાય?

- A. NaOH સાથે એસિડને ન્યૂટ્રલાઇઝ કરીને
- B. NaHCO₃ સાથે એસિડને ન્યૂટ્રલાઇઝ કરીને
- C. NaOH સાથે એલ્કોહોલને ન્યૂટ્રલાઇઝ કરીને
- D. HCl સાથે એલ્કોહોલને ન્યૂટ્રલાઇઝ કરીને

76. ફિનોલને બાયનરી મિશ્રણમાંથી કેવી રીતે અલગ કરી શકાય?

- A. NaOH સાથે હળવી ગરમી આપીને
- B. NaHCO₃ સાથે ગરમી આપીને
- C. NaOH અને પછી H₂O₂ ઉમેરીને
- D. H₂SO₄ ઉમેરીને

77. મિશ્રણમાં એલ્ડીહાઇડ અને કીટોન (Aldehyde & Ketone) કેવી રીતે ઓળખવા?

- A. એલ્ડીહાઇડ Tollen's પરીક્ષણ આપે છે, જ્યારે કીટોન નથી
- B. કીટોન Tollen's પરીક્ષણ આપે છે, જ્યારે એલ્ડીહાઇડ નથી
- C. કીટોન NaOH સાથે પ્રતિક્રિયા કરે છે, જ્યારે એલ્ડીહાઇડ નથી
- D. NaHCO₃ બંનેને ન્યૂટ્રલાઇઝ કરે છે

78. Choose the correct option: "These apples are fresh. I'll take the green ____."

- | | |
|--|---------|
| <input checked="" type="radio"/> A. Ones | C. Some |
| B. One | D. This |

79. એમાઈન અને ફેનોલ બાયનરી મિશ્રણમાંથી કેવી રીતે અલગ થાય છે?

- A. HCl સાથે ફેનોલને દૂર કરીને
- B. HCl સાથે એમાઈનને દૂર કરીને
- C. NaHCO₃ સાથે ફેનોલને દૂર કરીને
- D. HCl સાથે ફેનોલને દૂર કરીને

80. કઈ પદ્ધતિનો ઉપયોગ શાકભાજુ તેલ નીકળવા માટે થાય છે?

- | | |
|---------------------|--|
| A. કેમીકલ શુદ્ધિકરણ | <input checked="" type="radio"/> C. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્શનો |
| B. હાઇડ્રોલિસિસ | D. વિમલન |

81. તેલને શુદ્ધ કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે?

- A. ડિસ્ટિલેશન
- B. રિફાઇનિંગ
- C. કાર્ਬનાઇઝેશન
- D. પાવડર મિક્સિંગ

82. કયા પ્રકારના પોલિમરનું ફરીથી ઉપયોગ કરી શકાય છે?

A. થમોપ્લાસ્ટિક

B. થમોસેટ

C. પોલિએસ્ટર

D. પોલિથિન

83. "દ્વાષ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

A. પ્રેમ

C. કંકાશ

B. શાંતિ

D. રાગ

84. નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો

A. કમચારી

B. કમચારી

C. કાર્મચારી

D. કર્મચારી

85. નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો

A. નિરાત

C. નીરાત

B. નિરાંત

D. નીરાંત

86. નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો

A. દીવ્યતા

C. દિવ્યત

B. દિવ્યતા

D. દિવ્યત

87. કયો પોલિમર ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન માટે ઉપયોગી છે?

A. પોલિપ્રોપિલિન

B. પોલિસ્ટીરિન

C. પોલી વિનાઇલ ક્લોરાઇઝ

D. નાયલોન

88. લેસેની ટેસ્ટ (Lassaigne's Test) કયા મેટલનો ઉપયોગ નાઈટ્રોજન, ગંધક અને

હુલોજન તત્વોની ઓળખ માટે થાય છે?

A. સોડિયમ

B. પોટેશિયમ

C. લિથિયમ

D. બેરિયમ

89. તેલ નિર્જરણ નો કથો કમ યોગય છે?

- A. બીજનો પાઉડર, ગરમી, તેલ
- B.** બીજનો પાઉડર, દબાણ, તેલ
- C. બીજ, ગરમી, પાઉડર
- D. બીજ, પાણી, તેલ

90. કયું સાધન રસાયણોનું ચોક્કસ પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાય છે?

- A. બીકર
- B.** બ્યુરેટ
- C. ફિલાસ્ક
- D. ટેબલ બેલેન્સ

91. કોઈ પ્રતિક્રિયાની મોલેક્યુલરિટી શું હોઈ શકે છે?

- A. ભાગ્યંક
- B.** શૂન્ય
- C.** પુર્ણિક
- D. અનંત

92. નોર્માલિટી (Normality) નું પ્રમાણ શું છે?

- A. મોલ દીઠ દ્વયનું વજન
- B. મોલ દીઠ દ્રાવણનું વજન
- C. મોલ દીઠ સમાન આવશ્યક તત્ત્વો
- D.** લિટર દીઠ સમાન ગ્રામ ઇક્વિવેલન્ટ

93. સ્ટાન્ડર્ડ એસિડ સોલ્યુશનને તૈયાર કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ પરિબળો કયા છે?

- A. તાપમાન અને દબાણ
- B. દ્રાવણનો પીએચ
- C. એસિડ અને પાણીનું પાયમાનું
- D.** મોલક વજન અને વોલ્યુમ

94. જો કોઈ તત્ત્વનું અણુભાર 40 અને આવશ્યકતા 2 છે, તો તેનો સમાન વજન (Equivalent Weight) શું હશે?

- A.** 20
- B. 40
- C. 80
- D. 02

95. નીચેનામાંથી સૌથી જ સૌથી લાંબી નદી છે?

- A. નર્મદા નદી
- B.** નિલ નદી
- C. મિસિસિપી નદી
- D. યંગાત્સે નદી

96. વિશ્વનો સૌથી મોટો દેશ ક્યો છે?

- A. રષીયા
- B. ચીન
- C. યુનાઇટેડ સ્ટેટ્સ
- D. ભારત

97. આલ્યુમિનિયમ (Al) નો સમાન વજન (Equivalent Weight) શું છે? (Atomic Weight = 27, Valency = 3)

- A. 9
- B. 27
- C. 3
- D. 18

98. ક્યો સૂત્ર અણુભાર અને મોલાર દ્રવ્ય સાથે જોડાય છે?

- A. અણુભાર = મોલાર દ્રવ્ય × અવોગાડ્રો સંખ્યા
- B. અણુભાર = મોલાર દ્રવ્ય / અવોગાડ્રો સંખ્યા
- C. અણુભાર = મોલાર દ્રવ્ય / ધટક સંખ્યા
- D. અણુભાર = મોલાર દ્રવ્ય × 100

99. લેસૈની ટેસ્ટ (Lassaigne's Test) સોડિયમ ફ્યૂઝની પ્રતિક્રિયા પછી કયું દ્રાવણ ઉમેરીને નાઈટ્રોજનને ઓળખી શક્કાય છે?

- A. ફેરિક ક્લોરાઇડ
- B. પોટેશિયમ પર્મેન્ઝેટ
- C. ફેરોસલ્ફેટ અને ફેરિક ક્લોરાઇડ
- D. સિલ્વર નાઈટ્રેટ

100. પદાર્થના ઘનત્વ માપવા માટે ક્યો ઉપકરણ વપરાય છે?

- A. હાઇડ્રોમીટર
- B. સ્પેક્ટ્રોમીટર
- C. પિપેટ
- D. મિનીસ્ક્રસ

101. વિશ્વનો સૌથી મોટો મહાસાગર ક્યો છે?

- A. અટલાન્ટિક મહાસાગર
- B. હિંદ મહાસાગર
- C. પ્રશાંત મહાસાગર
- D. આર્કિટિક મહાસાગર

102. એક્સ્�સીલમાં "=SUM(A1:A10)" શું કરે છે?

- A. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો ગુણાકાર કરે છે
- B. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો ભાગાકાર કરે છે
- C. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો સરવાળો કરે છે
- D. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો બાદબાકી કરે છે

103. રસાયણિક પ્રક્રિયાઓ માટે લેબોરેટરીમાં કઈ ગેસ મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે?
- A. હાઇડ્રોજન
 - B. મિથેન
 - C. નાઇડ્રોજન
 - D. ઓક્સિજન
104. $2N\ H_2SO_4$ સોલ્યુશન માં, H_2SO_4 ના કેટલા મોલ્સ હશે?
- A. 1 મોલ
 - B. 2 મોલ
 - C. $1/2$ મોલ
 - D. $2/3$ મોલ
105. સાઇઝ રિડક્ષનના (Size Reduction) લક્ષ્ય માટે કયા પદ્ધતિનું ઉપયોગ કર્ણોને અલગા (Particles separate) કરવા માટે થાય છે?
- A. સબલિમેશન
 - B. સેન્ટ્રિફ્યુગેશન
 - C. ડિસ્ટ્રિલેશન
 - D. કિસ્ટલાઇઝેશન
106. 10% (w/v) NaCl સોલ્યુશન નો અર્થ શું છે?
- A. 10 ગ્રામ NaCl 100 મીલીલિટર સોલ્યુશનમાં
 - B. 10 ગ્રામ NaCl 1000 મીલીલિટર સોલ્યુશનમાં
 - C. 10 મોલ NaCl 1 લિટર સોલ્યુશનમાં
 - D. 10 મિલિએક્વિવેલન્ટ NaCl 1 લિટર સોલ્યુશનમાં
107. એક્સેલમાં ચાર્ટ શું છે?
- A. ટેક્સ્ટ સ્ટ્રિંગ
 - B. નંબર
 - C. ડેટાનું દર્શય રજૂઆત
 - D. ઓપરેશન કરવા માટેનું સૂત્ર
108. એક્સેલમાં ફિલ્ટરનો ઉપયોગ શા માટે થાય છે?
- A. ડેટાને સોંટ કરવા માટે
 - B. ડેટાને શોધવા માટે
 - C. ડેટાને ફોર્મેટ કરવા માટે
 - D. ડેટાને દર્શાવવા માટે

109. કલાઉડ પોઇન્ટ અને પોર પોઇન્ટ માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
- કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બાથ પદ્ધતિ
 - હાઇડ્રોમીટર પદ્ધતિ
 - સ્પેક્ટ્રોફોટોમેટ્રી પદ્ધતિ
 - ટાઇટ્રેશન પદ્ધતિ
110. વિષ્ણેષણાત્મક રસાયણશાસ્ક્રમાં 'ટાઇટ્રેશન' શું છે?
- એક દ્રાવક દ્વારા પદાર્થને ત્વરિત કરવું
 - એક પદાર્થની માત્રા માપવા માટે પદાર્થને નમૂનાઓ સાથે માપવું
 - પદાર્થને તાપમાનમાં ફેરફાર કરવું
 - પદાર્થને વિશિષ્ટ તેજસ્વિત પદ્ધતિથી શોધવું
111. "મોલારિટી" (M) ની વ્યાખ્યા શું છે?
- પદાર્થના મોલ્સ પ્રતિ 1 લિટર સોલ્યુશન
 - પદાર્થના ગ્રામ પ્રતિ 1 મીલીલિટર સોલ્યુશન
 - પદાર્થની દ્રાવ્યતા
 - પદાર્થનો વોલ્યુમ
112. Active Charcoal નો ઉપયોગ કચા પ્રકારના નિર્વાહ માટે થાય છે?
- સોલિડ ઘટકોને અલગ કરવું
 - પદાર્થની કલર દૂર કરવું માટે
 - સુગંધિત પદાર્થોને ફિલ્ટર કરવું
 - તેલને પદાર્થોમાંથી દૂર કરવું
113. Choose the correct option: "Who owns _____ bicycles over there?"
- This
 - That
 - Those
 - These
114. "સોડિયમ બાઇકાર્બોનેટ" નો ઉપયોગ કચા પ્રકારના ઓર્ગેનિક મિશ્રણને અલગ કરવા માટે થાય છે?
- એસિડિક અને બેઝિક ઓર્ગેનિક પદાર્થોને
 - મિશ્રણમાં આવેલા પદાર્થોની તાપમાન માપવા માટે
 - પદાર્થોની ગંધને દૂર કરવા માટે
 - પદાર્થોની રંગતને માપવા માટે

115. કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય?
A. 100 C. 200
B. 150 D. 250

116. જો એક વસ્તુ રૂ 1200 માં ખરીદી ને રૂ 1104 માં વેચતા, કેટલા ટકાનું નુકસાન થયું કહેવાયાં?
A. 5 C. 9
B. 6 D. 8

117. કયું ઉદાસીન વાયુ (Noble gases) લાઇટ બલ્બમાં ભરવામાં આવે છે?
A. ઓગ્ઝન C. કાર્બન ડાઇઓક્સાઇડ
B. ઓક્સિજન D. હીલીયમ

118. સેમી-માઇક્રો inorganic વિશ્લેષણમાં કયા માપના નમૂનાઓ લેવામાં આવે છે?
A. 10 mg C. 500 mg
B. 100 mg D. 5 g

119. કયા પરીક્ષણથી હલકા ધાતુઓના ધાતુઓને ઓળખી શકાય છે?
A. આગના પરીક્ષણથી
B. લીટમસ. પેપર પરીક્ષણ
C. કાચનું પરીક્ષણ
D. કાર્બનના પરીક્ષણ

120. Zn^{2+} આયનને ઓળખવા (Identification) માટે કયો ચકાસણો (test) કરવામાં આવે છે?
A. NaOH સાથે સફેદ અવક્ષેપ
B. NH₄Cl સાથે પીળો અવક્ષેપ
C. K₄[Fe(CN)₆] સાથે લાલ અવક્ષેપ
D. HCl સાથે લીલો અવક્ષેપ

121. ઓર્ગાનિક મોલેક્યુલમાં (Organic Molecules) નાઇટ્રોજનની હાજરી કેવી રીતે ઓળખી શકાય છે?
A. ડાયમિન-ઓટમોલ સોલ્યુશન દ્વારા
B. લિટમસ પેપર દ્વારા
C. Lassaigne's Test
D. નાયટ્રોટ વાયદા

122. બિનસંતૃપ્ત કાર્ਬનિક સંયોજનોમાં કયો પરીક્ષણ બિનસંતૃપ્ત બંધોને ઓળખે છે?
- બ્રોમાઇન પાણી પરીક્ષણ
 - ફેરીક ક્લોરાઇડ પરીક્ષણ
 - ટોલેન્સ પરીક્ષણ
 - બેન્ડિક્ટ પરીક્ષણ
123. નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો
- પ્રશંશા
 - પ્રસંશા
 - પ્રસંશા
 - પ્રસનાશ *none of these.*
124. "સાઈ જીવનની રેગોળી" આ પેંકિની કથા પાઠ સાથે સંકળાયેલી છે?
- મહાત્મા ગાંધી
 - પ્રભાત
 - આનંદીબહેન
 - આકાશ
125. "હું જગતને પ્રેમ કરું છું" આ લેખનનું લેખક કોણ છે?
- મહાત્મા ગાંધી
 - ઝવેરચંદ મેધાણી
 - કાન્દિલાલ જાવેરી
 - નર્મદ
126. બાયનરી મિશ્રણમાંથી કાર્બનિક એસિડને અલગ કરવા માટે કયા વિઘટકનો ઉપયોગ થાય છે?
- NaOH
 - HCl
 - NaHCO_3
 - H_2SO_4
127. કઈ તેલ મેળવવાની પદ્ધતિ શ્રેષ્ઠ ગુણવત્તાનું તેલ આપશે?
- સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્શન
 - હીટ પ્રેસિંગ
 - કોલ પ્રેસિંગ
 - કાયમી પ્રેસિંગ

128. "લિક્વિડ-લિક્વિડ એક્સટ્રાક્શન" પદ્ધતિનો ઉપયોગ શું માટે થાય છે?

- A. આઇસોલેશન અને શુદ્ધિકરણ (Isolation and Purification)
- B. પદાર્થને ગરમ કરીને તેની પાનીને દૂર કરવા માટે
- C. સોલિડ પદાર્થોને પાઇપેટ વડે વહન કરવા માટે
- D. લિક્વિડ પદાર્થોને કિસ્ટલાઇઝ કરવાના

129. કયો ગુણ પોલિમરની ગુણવત્તા નક્કી કરે છે?

- A. વજન.
- B. સાંક્રતા
- C. મોલેક્યુલર વજન.
- D. ઘનતા

130. "પ્રભાત" કાવ્યના કવિ કોણ છે?

- A. મકરંદ દવે
- B. નરસિંહ મહેતા
- C. કાન્તિ પટેલ
- D. ઉમાશંકર જોશી

131. "ગાંધીબાપુના ચમકારા" પાઠના લેખક કોણ છે?

- A. માધવ રામાનુજ
- B. જવેરચંદ મેધાણી
- C. મકરંદ દવે
- D. ઉમાશંકર જોશી

132. કયા ઉપકરણનો ઉપયોગ માપવા માટે થાય છે?

- A. બીકર
- B. બ્યુરેટ
- C. બ્યુન્સન બર્નર
- D. પિપેટ

133. Which sentence uses the correct article?

- A. They live in the big house.
- B. I saw a stars in the sky.
- C. She is an best student in the class.
- D. We bought a apples from the market.

134. Choose the correct option: " _____ is my house across the street."

- A. These
- B. Those
- C. That
- D. This

135. NaCl નું 1 M દ્રાવણ કેવી રીતે તૈયાર કરશો?
- 58.44 ગ્રામ NaCl ને 1 લિટર પાણીમાં ઓગાળો
 - 58.44 ગ્રામ NaCl ને 100ml પાણીમાં ઓગાળો
 - 58.44 ગ્રામ NaCl ને 10ml પાણીમાં ઓગાળો
 - 58.44 ગ્રામ NaCl ને 1000 ગ્રામ methanol માં ઓગાળો
136. ન્યુટ્રલ FeCl₃ ટેસ્ટ કયા પ્રકારના સંયોજનો માટે નકારાત્મક પરિણામ આપે છે?
- ફેનોલ્સ
 - આલ્કોહોલ
 - કાર્બોક્સિલિક એસિડ
 - એસ્ટર
137. કયા સમૂહના test માટે સિલ્વર નાઇટ્રોટ (AgNO₃) ટેસ્ટ કરવામાં આવે છે?
- કાર્બોનેટ
 - ક્લોરાઇડ
 - સલ્ફેટ
 - નાઇટ્રોટ
138. કયા પાત્રનો ઉપયોગ લેબોરેટરીમાં પ્રવાહી ઉકળવા માટે થાય છે?
- બીકર
 - ફલાસ્ક
 - ક્યુલેટ
 - ટિફ્રેટર
139. લેબોરેટરીમાં કયો ઉપકરણ માપવામાં આવતો પ્રવાહીનું ચોક્કસ પ્રમાણ દર્શાવે છે?
- પાઇપેટ
 - બ્યુન્સન બર્નર
 - બ્યુરેટ
 - બીકર
140. ₹ 1,000 નું 6% લેખે ત્રણ માસ નું વ્યાજ કેટલું થાય?
- ₹ 05
 - ₹ 15
 - ₹ 10
 - ₹ 25
141. 1, 4, 9, 16,?
- 30
 - 20
 - 35
 - 25
142. 2 મોલ/લિટર ફોર્મેલિટી ધરાવતું દ્રાવણ શું દર્શાવે છે?
- દ્રાવણમાં 2 મોલ દ્રવ્ય છે
 - દ્રાવકમાં 2 ગ્રામ દ્રવ્ય છે
 - દ્રાવણમાં 1 મોલ દ્રવ્ય છે
 - દ્રાવણમાં 0.5 મોલ દ્રવ્ય છે

143. કૃતિમ રીતે ઇથેનોલ કેવી રીતે તૈયાર (Preparation of synthetic ethanol) કરી શકાય છે?
- A. ઇથિનના હાઇડ્રોશનમાં
 - B. મિથેનના હાઇડ્રોશનથી
 - C. પોપેનના ઓક્સિડેશનથી
 - D. બ્યુટેનના વિમલનથી
144. બે ઓર્ગેનિક તત્વોને કિસ્ટલાઇઝનશન દ્વારા અલગ કરવા માટે કયો ગુણધર્મ ઉપયોગી છે?
- A. ઉકાળાનો બિંદુ
 - B. ઓગાળવાનો બિંદુ
 - C. દબાણ
 - D. ઘનતા
145. કથા પ્રકારની મિલ સાઇડ રિડક્ષન માટે ખાસ કરીને યોગ્ય છે?
- A. હમર મિલ (Hammer Mill)
 - B. રોલ મીલ (Roll Mill)
 - C. બાઉલ મીલ (Bowl Mill)
 - D. વેઇટ મીલ (Weight Mill)
146. "ભક્તિ પરંપરા"નો મુખ્ય કવિ કોણ હતો?
- A. અક્ષરધામ
 - B. દયારામ
 - C. મકરદ દવે
 - D. નરસિંહ મહેતા
147. ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે?
- A. નરસિંહ મહેતા
 - B. પ્રેમાનંદ
 - C. ઉમાશંકર જોશી
 - D. કવિ નર્મદ
148. 'મહાત્મા નાજુકબંધના' આ વાક્ય કોણે લખ્યું છે?
- A. મહાત્મા ગાંધી
 - B. રવીન્દ્રનાથ ટાગોર
 - C. નર્મદ
 - D. કવિ નર્મદ
149. કોઈ તત્વનું સમાન વજન (Equivalent Weight) કેવી રીતે ગણાય છે?
- A. અણુભાર / આવશ્યકતા
 - B. મોલાર દવ્ય / આવશ્યકતા
 - C. મોલાર દવ્ય / પદાર્થનું ઘનત્વ
 - D. આવશ્યકતા / અણુભાર
150. "500 મીલીલિટર (ml) 0.5 M HCl" તૈયાર કરવા કેટલા મીલીલિટર "2 M HCl" ની જરૂર પડશે?
- A. 125 મીલીલિટર
 - B. 250 મીલીલિટર
 - C. 100 મીલીલિટર
 - D. 150 મીલીલિટર